

Seat No : \_\_\_\_\_

No. of Printed Pages : 2

83/A28  
Guj

સરદાર પટેલ યુનિવર્સિટી  
બી. એસ. સી. સેમેસ્ટર - 3 પરીક્ષા

વિષય : અકાર્બનિક રસાયણ શાસ્ત્ર

Paper Code - US03CCHE21

તારીખ : ૨૨ -૧૧ -૨૦૧૯

સમય : 02.00 pm to 05.00pm

દિવસ : શુક્રવાર

કુલ ગુણ : ૭૦

સુચના : (1) દરેક પ્રશ્નના જવાબ આપો.

(2) પ્રશ્નની જમાણી બાજુ દર્શાવેલાં અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

પ્રશ્ન - ૧

સાચો વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ૧૦

૧. દ્રાવકો તેમના સૂત્રમાં હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે.

(અ) એસિડિક (બ) પ્રોટોનિક (ક) પ્રોટોજનિક (સ) પ્રોટોફિલિક

૨. નીચેનામાંથી કથો લેવીસ એસીડ નથી?

(અ)  $\text{SO}_3^{2-}$  (બ)  $\text{Cu}^{2+}$  (ક)  $\text{AlCl}_3$  (સ)  $\text{Me}_3\text{B}$

૩.  $\text{Ni}(\text{CO})_4$  માં \_\_\_\_\_ પ્રકારનું સંકરણ ધરાવે છે.

(અ)  $d\text{sp}^2$  (બ)  $\text{sp}^3$  (ક)  $\text{sp}^3\text{d}^2$  (સ)  $d^2\text{sp}^3$

૪. નીચેના સમતલીય ચોરસ સંક્રીણ સંયોજનમાં સીસ અને ટ્રાન્સ સમઘટકિય સ્વરૂપ અસ્તિત્વમાં એ ?

(અ)  $\text{Ma}_2\text{b}_2$  (બ)  $\text{Ma}_4$  (ક)  $\text{Ma}_3\text{b}$  (સ)  $\text{Mabod}$

૫. દેન્થેનાઈડની સૌથી સ્થિર ઓક્સિડેશન સ્થિતિ ---- છે.

(અ) +1 (બ) +3 (ક) +2 (સ) +4

૬. કથ્ય તત્વની ઇલેક્ટ્રોનિક રથના  $\{\text{Rn}\}5\text{f}^{12}6\text{d}^07\text{s}^2$  છે ?

(અ) U (બ) La (ક) Fm (સ) Na

૭. રેર અર્થનો અધિકતમ સ્વોત \_\_\_\_\_ છે.

(અ) મોનોજાઈટ રેતી (બ) બર્સનૈસાઈટ (ક) દરિયાનું પાણી (સ) ઐનોનોટાઈમ

૮. \_\_\_\_\_ EAN નિયમનું પાલન કરતું નથી

(અ)  $[\text{Mn}(\text{CO})_6]$  (બ)  $[\text{Cr}(\text{CO})_6]$  (ક)  $[\text{Fe}(\text{CO})_5]$  (સ)  $[\text{Ni}(\text{CO})_4]$

૯. કાર્બોનીલમાં ધાતુની ઓક્સિડેશન સ્થિતિ ----- છે.

(અ) -6 (બ) +2 (ક) 0 (સ) +7

૧૦. \_\_\_\_\_ એ સામાન્ય તાપમાને પ્રવાહી હોતું નથી.

(અ)  $[\text{Ni}(\text{CO})_4]$  (બ)  $[\text{Fe}(\text{CO})_5]$  (ક)  $[\text{Ru}(\text{CO})_5]$  (સ)  $[\text{Cr}(\text{CO})_6]$

પ્રશ્ન - ૨

નીચેના પ્રશ્નોના ટ્રેકમાં જવાબ આપો.. (ગમે તે દસ)

૨૦

૧. એસીડ-બેઇઝની સાપેક્ષ શક્તિનું માપન ખૂબ મુશ્કેલ છે, સમજાવો.

૨. દ્રાવક તરીકે  $\text{NH}_3$  ના ફાયદાઓની ચર્ચા કરો

૩. એમોનિયા પ્રોટોન સ્વીકારક છે સમજાવો.

૧

(PTO)

૪. VBT ની બે મર્યાદાઓ જણાવો.
૫.  $\text{CrCl}_3 \cdot 6\text{H}_2\text{O}$  ના બધા હાઇડ્રો સમઘટકોના અણુસૂત્ર અને તેના ભૌતિક ગુણધર્મો આપો.
૬. સમઘટકતા એટલે શું ?
૭. લેન્થેનાઈડ અને એક્ટિનાઈડની સામાન્ય ઇલેક્ટ્રોનિક ગોઠવણી જણાવો.
૮. તબીબી અને બેતીવાડીમાં લેન્થેનાઈડનો ઉપયોગ જણાવો.
૯. લેન્થેનાઈડને અલગ કરવા માટે ઉપયોગમાં લેવાતી આધુનિક પદ્ધતિઓની ચાદી આપો.
૧૦.  $[\text{Co}_2(\text{CO})_8]$ ના EAN ની ગણતરી કરો.
૧૧. યોગ્ય ઉદાહરણો આપી ધાતુ કાર્બોનીલને વળ્ણિકૃત કરો.
૧૨.  $\text{Fe}_3(\text{CO})_{12}$ નું બંધારણ દોરો.

પ્રશ્ન- ૩ ઇલેક્ટ્રોન-જોડી દાતા-સ્વીકારનાર પ્રણાલીનો લેવિસ ખ્યાલ શું છે ? લેવિસ એસિડના ૧૦ વળ્ણિકરણની ચર્ચા કરો. લેવિસ ખ્યાલની ઉપયોગિતા અને મર્યાદાઓ પણ જણાવો.

#### અથવા

નીચે દર્શાવેલા મુદ્દાઓ પ્રમાણે પ્રવાહી એમોનિયા દ્રાવકની પ્રક્રિયાઓ વર્ણવો.

૧૦

- (i) મેટાથેટિકલ અથવા અવક્ષેપન પ્રક્રિયાઓ (ii) એસિડ-બેઝ તત્ત્વશીકરણ પ્રક્રિયાઓ
- (iii) રેડોક્ષ પ્રક્રિયાઓ (iv) એમોનેશન પ્રક્રિયા

પ્રશ્ન- ૪ (અ) VBT ક્ષારા  $[\text{Fe}(\text{CN})_6]^{4-}$  નું બંધારણ અને ચુંબકીય ગુણધર્મો સમજાવો. ૦૫  
 (બ) સંકિર્ણ  $[\text{Pt}(\text{NH}_3)_2\text{Cl}_2]^0$  ના સીસ અને ટ્રાંસ સમઘટક વર્ણનો સેદ સમજાવવાની ગ્રીનબર્જ પદ્ધતિનું વર્ણન કરો. ૦૫

#### અથવા

- (અ) સમજાવો:  $[\text{Ni}(\text{CN})_4]^{2-}$   $\text{dsp}^2$  સંકરણ ધરાવે છે ૦૫
- (બ) સમતલીય ચોરસ સંકિર્ણમાં પ્રકાશીય સમઘટકતા ભાગ્યેજ જોવા છે, સમજાવો ૦૫
- પ્રશ્ન- ૫ (અ) લેન્થેનાઈડ સંકોચન પર નોંધ લખો. ૦૫  
 (બ) લેન્થેનાઈડ તત્ત્વોના નામ, સંજ્ઞા, પરમાણુ કમાંક અને ઇલેક્ટ્રોનિક રચના જણાવો. ૦૫

#### અથવા

- (અ) એક્ટિનાઈડ તત્ત્વોના નામ, સંજ્ઞા, પરમાણુ કમાંક અને ઇલેક્ટ્રોનિક રચના આપો. ૦૫
- (બ) એક્ટિનાઈડની જુદીજુદી ઓક્સિડેશન સ્થિતિઓની ચર્ચા કરો. ૦૫

પ્રશ્ન- ૬ (અ)  $[\text{Ni}(\text{CO})_4]$  ની બનાવટ, ગુણધર્મો અને બંધારણની ચર્ચા કરો. ૦૫  
 (બ) ધાતુ કાર્બોનીલમાં M-CO ના બંધન પ્રકૃતિની ચર્ચા કરો ૦૫

#### અથવા

- (અ) સોડિયમ નાઇટ્રોપુસાઈડ પર નોંધ લખો. ૦૫  
 (બ)  $\text{Co}_2(\text{CO})_8$  ની બનાવટ, ગુણધર્મો અને બંધારણની ચર્ચા કરો. ૦૫

83/A28  
Eng

Seat No.:

No. of Printed Pages : 2

Sardar Patel University

B.Sc. Semester-3 Examination

Subject:- Inorganic Chemistry

Paper Code - US03CCHE21

Date: 22-11-2019

Time: 02.00 pm to 05.00pm

Day: Friday

Total Marks: 70

Note: (1) All questions are to be attempted

(2) Figures to the right indicate full marks.

Que-1

Choose the correct option and rewrite answer of the following.

10

1. \_\_\_\_\_ Solvents have hydrogen atom in their formula.  
(a) Acidic (b) Prototic (c) Protogenic (d) Protophilic
2. Which one of the following is not Lewis acid ?  
(a)  $\text{SO}_3^{2-}$  (b)  $\text{Cu}^{2+}$  (c)  $\text{AlCl}_3$  (d)  $\text{Me}_3\text{B}$
3.  $\text{Ni}(\text{CO})_4$  has \_\_\_\_\_ type of hybridization.  
(a)  $\text{dsp}^2$  (b)  $\text{sp}^3$  (c)  $\text{sp}^3\text{d}^2$  (d)  $\text{d}^2\text{sp}^3$
4. Which of the following square planar complexes exist in cis and trans isomeric form?  
(a)  $\text{Ma}_2\text{b}_2$  (b)  $\text{Ma}_4$  (c)  $\text{Ma}_3\text{b}$  (d)  $\text{Mabcd}$
5. The most stable oxidation state of lanthanide is -----.  
(a) +1 (b) +3 (c) +2 (d) +4
6.  $\{\text{Rn}\}5\text{f}^126\text{d}^07\text{s}^2$  is electronic configuration of which elements ?  
(a) U (b) La (c) Fm (d) Na
7. The richest source of rare earth is \_\_\_\_\_.  
(a) monozite sand (b) bastnaisite (c) sea water (d) xenotime
8. ----- is not obey EAN rule.  
(a)  $[\text{Mn}(\text{CO})_6]$  (b)  $[\text{Cr}(\text{CO})_6]$  (c)  $[\text{Fe}(\text{CO})_5]$  (d)  $[\text{Ni}(\text{CO})_4]$
9. The metal in carbonyls are in ----- oxidation state.  
(a) -6 (b) +2 (c) 0 (d) +7
10. \_\_\_\_\_ is not liquid at ordinary temperature.  
(a)  $[\text{Ni}(\text{CO})_4]$  (b)  $[\text{Fe}(\text{CO})_5]$  (c)  $[\text{Ru}(\text{CO})_5]$  (d)  $[\text{Cr}(\text{CO})_6]$

Que-2

Answer the following short questions. (Any Ten)

20

1. Relative Strength determination of Acid-Base is very difficult, explain.
2. Discuss the advantages of  $\text{NH}_3$  as solvent
3. Explain ammonia as a proton accepter.
4. Give two limitations of VBT.

①

(P.T.O)

5. Give the molecular formula of all the hydrate isomers of  $\text{CrCl}_3 \cdot 6\text{H}_2\text{O}$  and its physical properties.
6. What is isomerism ?
7. Give general electronic configuration of lanthanides and actinides
8. Give use of Lanthanides in medical and agriculture fields
9. List the modern methods used for the separation of Lanthanides.
10. Calculate EAN of  $[\text{Co}_2(\text{CO})_8]$ .
11. Classify the metallic carbonyls giving suitable examples.
12. Draw the structure of  $\text{Fe}_3(\text{CO})_{12}$ .

**Que-3** What is lewis concept of the electron-pair donor-acceptor system ? Discuss 10  
Classification of Lewis Acids. Also give utility and limitations of Lewis concept.

**OR**

Describe the reactions of liquid ammonia solvent under the following headings. 10

- (i) Metathetical or precipitation reactions (ii) Acid-Base neutralisation Reactions
- (iii) Redox reactions (iv) Ammonation reaction

**Que-4** (a) Explain : The structure and magnetic properties of  $[\text{Fe}(\text{CN})_6]^{4-}$  by VBT 05  
(b) Describe a Grinberg's method to distinguish between cis and trans isomers of the complex  $[\text{Pt}(\text{NH}_3)_2\text{Cl}_2]^0$ . 05

**OR**

- (a) Explain :  $[\text{Ni}(\text{CN})_4]^{2-}$  has  $\text{dsp}^2$  hybridization. 05
- (b) Explain: Optical isomerism rarely occurs in square planar complexes. 05

**Que-5** (a) Write a note on Lanthanide contraction. 05  
(b) Give the name, symbol, atomic number and electronic configuration of lanthanides. 05

**OR**

- (a) Give the name, symbol, atomic number and Electronic configuration of actinides elements. 05
- (b) Discuss the various oxidation states exhibited by actinides. 05

**Que-6** (a) Discuss the Preparation, Properties and structure of  $[\text{Ni}(\text{CO})_4]$ . 05  
(b) Discuss the nature of M-CO bonding in metal carbonyl. 05

**OR**

- (a) Write note on sodium nitroprusside. 05
- (b) Discuss the preparation, properties and structure of  $\text{Co}_2(\text{CO})_8$ . 05